

# રાજકોટ મહાનગરપાલિકા

ડો. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧

-: અખબારી યાદી:-

શહેરમાં જાહેર સ્થળોએ થુંકતા વ્યક્તિઓ પાસેથી રૂ. ૩૫,૪૫૦/- નો

ઠંડ વસુલ કરાયો: મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ

જાહેરમાં ગંદકી કરતા આસામીઓ પાસેથી કુલ રૂ. ૯,૮૫૦ નો ઠંડ વસુલાયો

તારીખ: ૧૮-૦૩-૨૦૨૦

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના (COVID-19) વાઇરસને અટકાવવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકનાર સામે કડક પગલા લેવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે તા. ૧૮-૦૩-૨૦૨૦ ના રોજ શહેરના ત્રણેય ઝોનની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેરમાં થુંકવાના જાહેરનામાના ભંગ કરતા આસામીઓ પાસેથી રૂ. ૩૫,૪૫૦/- નો ઠંડ વસુલ કરવામાં આવ્યો હતો, તેમજ જાહેર સ્થળોએ ગંદકી કરતા આસામીઓ પાસેથી કુલ રૂ. ૯,૮૫૦/- નો ઠંડ વસુલ કરવામાં આવ્યો હતો, આજરોજ જાહેરમાં થુંકતા અને જાહેરમાં ઠંડકી કરતા આસામીઓ પાસેથી કુલ રૂ. ૪૫,૩૦૦/- ના ઠંડની કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

વધુ માહિતી આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, સરકારશ્રીએ દ્વારા કોરોના વાઇરસ પર નિયંત્રણ લાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં થુંકતા વ્યક્તિઓને ઠંડ કરવામાં આવે છે, આજરોજ ત્રણેય ઝોનમાં આ કાર્યવાહી પુરજોશમાં ચાલે છે, જાહેરમાં થુંકનાર વ્યક્તિઓમાં સેન્ટ્રલ ઝોનમાંથી કુલ ૨૧ આસામીઓ પાસેથી રૂ. ૧૦,૫૦૦/- તેમજ ગંદકી કરતા કુલ ૮ આસામીઓ પાસેથી રૂ. ૨,૫૦૦/- નો ઠંડ વસુલ કરાયો, વેસ્ટ ઝોનમાંથી કુલ ૨૧ આસામીઓ પાસેથી રૂ. ૧૦,૫૦૦/- તેમજ ગંદકી કરતા કુલ ૬ આસામીઓ પાસેથી રૂ. ૩,૦૦૦/- નો ઠંડ વસુલ કરાયો અને ઈસ્ટ ઝોનમાંથી કુલ ૩૦ આસામીઓ પાસેથી રૂ. ૧૪,૪૫૦/- અને ગંદકી કરતા કુલ ૭ આસામીઓ પાસેથી ૪,૩૫૦/- નો ઠંડ વસુલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરી અંગે હજુ વધુને વધુ કામગીરી ચાલુ છે, જાહેર જનતાને કોરોના વાઇરસ અંગે જાગૃત થવા અને જાહેરમાં ન થુંકવા મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવે છે.

સમગ્ર કામગીરી ત્રણેય ઝોનના નાયબ કમિશનરશ્રીઓના માર્ગદર્શન હેઠળ આસી. કમિશનરશ્રીઓ, નાયબ પર્યવરણ ઈજનેરશ્રીઓ, મદદનીશ પર્યાવરણશ્રીઓ, વોર્ડ ઓફિસરશ્રીઓ, તમામ ઝોનના એસ.આઈ.શ્રીઓ અને એસ.એસ.આઈ.શ્રીઓ દ્વારા કરવામાં આવી હતી.

(જન સંપર્ક અધિકારી)

રાજકોટ મહાનગરપાલિકા